



Accredited Grade "B" by NAAC

# સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

પરીક્ષા વિભાગ ૦૨, યુનિવર્સિટી કેમ્પસ, યુનિવર્સિટી રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫  
ફોન નં. : (૦૨૮૧) ૨૫૭૬૫૧૧ એક્સટે. નં. ૭૩૪ / ૩૦૧ / ફેક્સ નં. : (૦૨૮૧) ૨૫૮૬૪૧૧  
ઈ-મેઈલ : exam02@sauuni.ac.in

No./Exam/02/1283/2022

Date:-17/03/2022

પરિપત્ર :

વિષય: મેડીકલ / પેરા મેડીકલ સિવાયના અનુસ્નાતક કોર્સના ડીઝર્ટેશન પરીક્ષા વિભાગ-૨ માં  
સબમિટ કરવા અંગે.

ઉપર્યુક્ત વિષય પરત્વે સંબંધિત સર્વેને જણાવવાનું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓ હેઠળની અનુસ્નાતક કક્ષાની લેવામાં આવતી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ની પરીક્ષાઓના ડીઝર્ટેશન પરીક્ષણ કાર્ય માટે પરીક્ષા વિભાગમાં જમા કરવાનું નિર્ધારિત થયેલ હોય તેવા ડીઝર્ટેશન પરીક્ષા વિભાગમાં જમા કરવા માટેની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૨૨ નિયત કરવામાં આવેલ છે.

વિદ્યાર્થીઓ માટે અનુસ્નાતક કોર્સની પરીક્ષા સંબંધિત ડીઝર્ટેશન પરીક્ષા વિભાગમાં જમા કરાવવા માટે નીચે મુજબના કોષ્ટક પ્રમાણેની, તારીખ/જોગવાઈઓ અમલમાં રહેશે.

ક્રમ નં.	ફી વિના પ્રવર્તમાન વર્ષના ડીઝર્ટેશન જમા કરવાની છેલ્લી તારીખ	રૂ. ૫૦૦/- લેહટ ફી સાથે ડીઝર્ટેશન જમા કરવાનો સમયગાળો	લેહટ ફી + દંડાત્મક ફી = કુલ ફી રૂ. ૫૦૦/- + રૂ. ૨૫૦૦/- = રૂ. ૩૦૦૦/- ફી સાથે ડીઝર્ટેશન સ્વીકારવાની શરૂઆત
૧	તા. ૩૧/૦૩/૨૦૨૨	તા. ૦૧/૦૪/૨૦૨૨ થી તા. ૧૫/૦૪/૨૦૨૨ સુધી	તા. ૧૬/૦૪/૨૦૨૨ થી

(૧) સને - ૨૦૧૭ થી થયેલ પરિપત્ર મુજબ પ્રમાણપત્ર, અનુક્રમણિકા, ફોટો, આલેખ, આકૃતિ વગેરે સિવાય પાનાની બન્ને સાઈડમાં ડીઝર્ટેશન ટાઈપ કરવાનું રહેશે.

(૨) પરિણામ બહાર ન પડે ત્યાં સુધી જો ડીઝર્ટેશનની નકલની જરૂરીયાત ઉપસ્થિત થશે તો જ્યારે પરીક્ષા વિભાગ-૦૨ મંગાવે ત્યારે સત્વરે ડીઝર્ટેશનની નકલ દિવસ ૦૭ (સાત) માં સંસ્થાએ પૂરી પાડવાની રહેશે.

(૩) સંસ્થાના ફોરવર્ડિંગ પત્રમાં વિદ્યાર્થીઓના અનુસ્નાતક નોંધણી નંબર અને અનુસ્નાતક નોંધણી તારીખ તેમજ પરીક્ષા ફોર્મની ફી ભર્યાના પહોંચ નંબર અને તારીખ અવશ્ય દર્શાવવાની રહેશે.

(૪) વિદ્યાર્થી દીઠ એક (૦૧) નકલ હાર્ડકોપીમાં ડીઝર્ટેશન તેમજ સોફ્ટકોપી સી.ડી. (CD)માં જમા કરવાના રહેશે.

પરીક્ષકની સંખ્યા સિવાયની વધારાની ડીઝર્ટેશનની (SPARE) નકલ જમા કરાવવાની નથી.

(૫) જે વિદ્યાર્થીઓએ અગાઉ થીયરીની પરીક્ષા આપેલ હોય અને તેનું પરિણામ, ડીઝર્ટેશન બાકી હોવાના કારણે અનામત હોય, તેવા વિદ્યાર્થીઓના ડીઝર્ટેશનની સાથે ગુણપત્રકની સ્વપ્રમાણિત નકલ બીડવાની રહેશે.

પ્રતિ,

(૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થિત ભવનના અધ્યક્ષશ્રીઓ.

(૨) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક સંસ્થાઓના વડાશ્રીઓ.

*Handwritten signature*  
પરીક્ષા નિયામક

P.T.O

**નકલ રવાના:**

૦૧. કુલપતિશ્રી / કુલસચિવશ્રીના અંગત સચિવશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૦૨. પરીક્ષા વિભાગ-૦૩, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૦૩. મુખ્ય હિસાબી અધિકારીશ્રી, હિસાબ વિભાગ
૦૪. ઓડીટરશ્રી, ઓડીટ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
૦૫. વિભાગીય અધિકારીશ્રી, પી.જી.ટી.આર. વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
૦૬. પરીક્ષા વિભાગ (બાહ્ય), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.
૦૭. પરીક્ષા કમ્પ્યુટર વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.